#### **GOLDCOIN HEALTH FOODS LIMITED**

Reg. Office : A-16, 1st Floor, Vardan Tower, Pragatinagar, Naranpura, Ahmedabad – 380 013

M.: 094267 68644

Email: goldcoinhealth@gmail.com CIN: L15419GJ1989PLC012041



Date: 23rd May, 2025

To, The Manager, Listing BSE Limited Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai- 400 001

SYMBOL: GOLDCOINHF

CODE: 538542

SUB: Submission of Notice Published in Newspaper

Dear Sir/Madam,

Pursuant to the provisions of Regulation 30 read with Schedule III of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith copy of the Notice published in Business Standard (English) and Jai Hind (Gujarati), Ahmedabad editions on 23<sup>rd</sup> May, 2025 under the signature of Mr. Devang P Shah, Managing director of the company, relating to Order passed by Hon'ble National Company Law Tribunal, Ahmedabad Bench, for reduction of capital of the Company.

Please acknowledge the communication.

For GoldCoin Health Foods Limited

Devang P. Shah Managing Director DIN: 00633868

CORRIGENDUM MRS. PARMEENA SHAHARWARDI W/O SHAHARWARDI KHAN

Please refer to Possession Notice published in this Newspaper, dated 16.05.2025, Kindly read the Co-Borrower : Mr. Khan Saharvardi S/o Badshah Khan instead of Guarantor : Mr. Khan Saharvardi S/o Badshah Khan.

All other details remain the same ate : 22.05.2025 Authorised Officer, Canara Bank

#### Public Notice

Notice is hereby given that the folio No 000060 and Share Certificate no 0000060 for 194 shares bearing distinctive no from 55348682 to 55348875 standing in the names of JAYA JAYANTILAL ASHAR in books of M/s. SIGNIFY INNOVATIONS INDIA LIMITED has been lost/misplaced and the advertiser has applied to the company for issue of duplicate share certificate in lieu thereof. Any person who has claims on the said shares should lodge such claims with the company's Registrar and transfer Agent -KFin Technologies Limited Selenium, Tower B, Plot No. 31-32, Gachibowli, Financial District. Nanakramguda, Hyderabad - 500 032.withiri 15 days from the date of notice failing which the company will proceed to issue duplicate share certificate to under signed in respect of the said shares.

(Asmita Rashmikant Shahl Date 22.05.2025 Place Vadodara

#### **PUBLIC NOTICE**

My Client is an Intending purchaser of the Flat No. A/3 on First Floor of Tower A in "Vrajdeep Apartment" situated on R.S.No. 149/1 149/2, 149/3, 150, City Survey No. 2062 to 2065, T.P. 14, F.P. 18. 20 of Moje Jetalpur, Vadodara from its owners Aruna Arvindbhai Patel. The Title Clearance Certificate is demanded. The original Sale Deed & Lodgement Receipt No. 377 Dated 29-01-1999 is not found. Any individual or Financial institution have any objection regarding Title of the mentioned property. Please inform with documentary evidence within 07 days of issuance of this Notice. If any objection may not received within stipulated time. The Title Clearance Certificate will be issued. Date: 23-05-2025.

413, Navrang Complex, Hotel Utshav Compound, Ravpura, Vadodara. Mo.9879524134

**ASHISH H. SHAH** (ADVOCATE)

#### :- PUBLIC NOTICE -:

Notice is hereby given to the public that, All the piece and parcel of Plot/House no. A-3, adm. 99.48 sq. mts. along with construction thereon of ground floor adm. 76.44 sq. mts. and first floor adm. 56.93 sq. mts. of R. S. No. 292/6, 292/2, 292-4+1, 292-4+2, 292/3 known as KAVITADHAM SOCIETY of moje Jhadeshwar, Tal. Bharuch, Dist. Bharuch owned by, Pinkeshbhai Kishorebhai Rana and proposed buyers are, I. Satishkumar Dipakbhai Prajapati and, 2. Prajapati Vaishaliben Satishkumar. Proposed buyers applied for loan from my client bank to purchase said property and therefore my client bank requested me to furnish title clearance report in respect of said property. Below mentioned documents are missing/misplaced. All the person, institute, having any claim in respect there of by way of sale, exchange, gift, possession, lease lien or otherwise howsoever are requested to inform the same in writing within 7 days from the date here of failing which the calims (if any) of such person or persons will be considered to have been waived and/or abandoned.

LIST OF MISSING ORIGINAL DOCUMENTS Original registration receipt of the sale deed no. 10739, dated:12/10/2010

Off.: 201, R K Square, Opp. Omkarnath Rajan J. Thakkar Hall, Near Shaktinath Circle, Bharuch. Mobile: 9825859868

(Advocate)

That our Client namely Soni Neel Ketankumar is willing to Purchase an Immovable Property situated at Mauje: Tarsali, Vadodara on NA land bearing Revenue Survey No. 180/1, City Survey 1860/A/2, Known as "HIGH – WAY CO. OP. HO. SO. LTD.", Plot No. C/287, Plot area admeasuring 79.00 Sq. Mtrs., Construction area admeasuring 40.89 Sq. Mtrs., at Registration Sub – District & District Vadodara, from its Present owner namely Pratap Uttamehand Chelani, and have therefore demanded for the Title Clearance Certificate of the said Property. That the said Property was previously owned by Padma Uttamchand Chelani through a Share Certificate Vides No.

330, Share Serial Nos. 931 – 935, (Duplicate No. 187), dated 07.02.1987, wherein the Said Original / Duplicate Share Certificate is found to be missing. Therefore if any individual, Bank, Society, Institution or Financial Institution has its rights, charge, encumbrances, or lien, by any means; on the said property, then within 14 days from the publication of the notice may send their objections along with the Supportive Evidence. If not sent within given period of time, then my client will initiate further proceedings.

TEREDESAI ASSOCIATES
SAPAN TEREDESAI (ADVOCATE) | PAYAL TEREDESAI (ADVOCATE) | DHRUV TEREDESAI (ADVOCATE) 407-409, 4th Floor, Bluechip Complex, Nr. Stock Exchange, Sayajigunj, Sayajigunj, Vadodara-5 Mo.: 7211181322


#### PUBLIC NOTICE FOR TITLE CLEARANCE

This public notice is hereby given to whomsoever may concern that the property pearing "Flat No. D/101" of the Building No. "D" known as "Swastik Residency" situated at Kumbhariya bearing Revenue Survey No. 308, Block No.: 283 of Surat City Distric Super Built up area 1068.00 Square Feet i.e. 99.25 Square Meters was owned by Swastik Developers, a partnership firm. Thereafter Swastik Developers, a partnership firm partners (1) Mr. Rameshbhai Govindbhai Kapopara, (2) Mrs Janrutihen Mukeshhhai Desai (3) Mrs. Rhartihen Ashishhhai Patel (4) Mr. Rajeshbhai Hiralal Patel, (5) Mr. Gunjanbhai Rambhai Sheladiya, (6) Mr Arvindbhai Parsottambhai Savaliya, himself and Power of attorney holder of Sr. Nos. (1) to (5) sold the said flat to Ramkali Mahavir Jangara by registered sale deed No. 11159 Dated: - 02.06.2012. My client Ramkali Mahavir Jangara has stated that she became the owner of the said property and that the original and copy of the power of attorney given by the previous owner of this property i.e. Swastik Developers, a partnership firm Partners, in favour of their authorized partner Arvindbhai Parsottambhai Savaliya have been lost or misplaced and She has demanded a title clearance certificate from us. If any person, Bank, or Financial institute has any interest in the said property, contact me with all relevant document at my address mentioned herein below within **07 days** of publication of this notice Upon expiration of the notice period, if no objection will be received, I will proceed urther. Thereafter nobody has any right, interest in the said property and if anybody has any rights or interest in the said property, he/she has waved the said right Subsequently No Objection will be considered. Which please note

Office No. 224-225, Second Floor, Galleria Shopping Hub, Behind Rajhans Cinema, Pal Road, Adaian, Surat, Mob. No. 9327411328

Ritesh A. Mehta

# DEBTS RECOVERY TRIBUNAL-II



NOTICE THROUGH PAPER PUBLICATION

BANK OF BARODA APPLICANT

VERSUS

M/S. OMINOX LUBRITECH MANUFACTURES LLP & ORS DEFENDANT

(1) M/S. OMINOX LUBRITECH MANUFACTURES LLP PLOT NO.9, SURVEY NO. 55 P 7, SHIVAJITEKRI, NEAR BHATHIJI TEMPLE, PARNERA, VALSAD - 396007

AND/OR 40/B, PRAMUKH DARSHAN IV, VASHIYAR, VALSAD - 396002

(2) NIKESHKUMAR NAVINBHAI RAJPUT DHOBIWAD, OPPOSITE MANGALDEEP, NEAR LAL SCHOOL, V P ROAD.

VALSAD-396001 AND/OR:

40/B, PRAMUKH DARSHAN IV, VASHIYAR, VALSAD - 396002 (3) RAJKUMAR RAGHAV

B-3/90, SECOND FLOOR, PASCHIM VIHAR, NEW DELHI, DELHI - 110063 (4) GANESH RAMBHAI NAIDU

DHOBIWAD, OPPOSITE MANGALDEEP, NEAR LAL SCHOOL, V P ROAD, VALSAD-396001 WHEREAS the above named applicant has filed the above referred application in this

A-303, SIDVINAYAK COMPLEX, MANIMEHATWAD, VALSAD - 396001

WHEREAS the service of Summons/Notice could not be effected in the ordinary manner and whereas the application for substituted service has been allowed by this

Defendant are hereby directed to show cause as to why the Original Application Should not be allowed. You are directed to appear before this Tribunal in person or through an Advocate or

28/07/2025 at 10.30 a.m. and file the written statement / Reply with a copy there of furnished to the applicant upon receipt of the notice.

Take notice that in case of default, the Application shall be heard and decided in you

GIVEN UNDER MY HAND AND SEAL OF THE TRIBUNAL ON THIS 19/05/2025 PREPARED BY CHECKED BY

(5) NAVINCHANDRA RAMJIBHAI RAJPUT



#### 🔰 बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda

MSME Branch: G -1/B & 1/A, Surana International Sahara Darwaja, Ring Road, Surat - 395002,

Possession Notice (for Immovable property) [Under Rule-8(1) of Security Interest (Enforcement) Rules, 2002] Whereas, The undersigned being the Authorized officer of the Bank of Baroda under the Whereas, the undersigned being the Authorized officer of the Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act and in exercise of powers conferred under section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 05.08.2024 calling upon the Borrowers/Mortgagor Mr. Harinarayan Ashrubhai Bajad (Borrower), Mrs. Gufaben Harinarayan Bajad (Co-borrower), Mr. Manoj Harinarayan Bajad (Co-borrower) & Mr. Prahlad Rambhau Aware (Guarantor) to repay the amount mentioned in the notice being Rs.28,09,464.99½ (Rupees Twenty Eight Lacs Nine Thousand Four Hundred Sixty Four and Ninety Six Paise Only) plus Interest and other charges within 60 days from the date of receipt of the said notice.

recipit of the said notice.

The Borrowers/guarantor having falled to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this the 18th day of the Way of the year 2025.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property will be subject to the charge of Bank of Baroda for an amount of Rs.28,09,464.96/- plus Interest and other charges.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

Equitable Mortgage of All that piece and parcel of the immovable property bearing Plot No. 90 of Shubh Residency constructed on the sub plot no. 2 having admeasuring about 8664 Sq. Mtrs. Lying and being at Revenue Survey No. 9, Block No. 9, situated at Moje Village: Karadava, Sub District: Choryasi, District: Surat total land admeasuring about 17608 og, Mtrs. Out of which the plot having admeasuring about 70 Sq. Yards i.e 50.22 Sq. Mtrs. Along with proportionate undivided share in the COP and road admeasuring about 26.01 Sq. Mtrs. i.e total area covered of the plot is 76.23 Sq. Mtrs. Surrounded by-East: Adjacent Internal Road of Society, West: Adjacent Plot No. 97, North: Adjacent Plot No. 91, South: Ad

Date: 18.05.2025,Place:Surat Authorized Officer, Bank of Baroda, MSME Branch, Surat

🎒 बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda

KHANDBAZAR BRANCH: Opp. Varachha Police Station, Varachha Road, Surat, Phone: (0261) 2544585

POSSESSION NOTICE [SECTION 13(4)] (For Immovable property) [Under Rule-8(1) of Security Interest (Enforcement) Rules 2002. Whereas, The undersigned being the authorized officer of the Bank Of Baroda under the ecuritization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 11.02.2025 calling upon the borrower/mortgagor Mr. VAGHABHAI DEVABHAI GALANI (Borrower), Mr. VASHRAMBHAI DEVABHAI GALANI (Co-Borrower) & Mrs. SHITALBEN NITINBHAI PATEL (Guarantor) to repay the amount mentioned in the notice being Rs.28.80,600.92/- (Rupees Twenty Eight Lakhs Eighty Thousand Six Hundred and paise Ninety Two Only) plus interest and other charges within 60 days from the date of receipt of the said notice.

The borrower/mortgagor having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this the day of 17th day of May of the year 2025. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in

espect of time available, to redeem the secured assets. respect of time available, to redeem the secured assets.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda for an amount of Rs.28,80,600.92/- plus interest and other Charges.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that piece and parcel of the immovable property bearing Makan/Tenement No. 1354 admeasuring 41.25 sq.mtrs. along with ground floor, first floor and second floor construction admeasuring built-up area &4.00 sc mtrs. standing thereon to other with leasehold rights in

admeasuring built-up area 84.00 sq.mtrs. standing thereon together with leasehold rights in land/plots and all super structure rights in the Colony No. 1465 LIG which is identified as "GAYATRI NAGAR" organized by "Gujarat Housing Board (S.H.B.)" and the whole scheme is situated on the land bearing Revenue Survey Nos. 5/1.6/1.6/2.7,8,9/1.9/2, 10/1 etc., Block Nos. 14, 15, 16, 24 to 28, 30 of Village: Chhaprabhatha, Sub-District: Surat City [New Sub-District: Adajan), District: Surat. Boundaries are:East: TS No. 1355, West: TS No. 1353 North: Adj. Road, South: TS No. 1337.

Date: 17.05.2025, Place: Surat. Authorized Officer, Bank of Baroda, Khandbazar Branch



FULPADA BRANCH: Satkar Complex, Katargam G.I.D.C, SUBAT-395008, Ph:02612481144. Email: fulpad@bankofbaroda.co.in

Possession Notice (for Immovable property) [Under Rule-8(1) of Security Interest (Enforcement) Rules, 2002] Whereas, The undersigned being the authorized officer of the Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 17.02.2025 calling upon the borrower/mortgagor MR. AKSHAYKUMAR RASIKBHAI MARCHANT (Borrower) & MRS. RAXABEN MARCHANT (Co-borrower) to repay the amount entioned in the notice being Rs.1,48,587.85 (Rupees One Lakhs Forty Eight Thousand Five Hundred Eighty Seven and Eighty Five Paise only) within 60 days from the date o

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this the day of 19th day of MAY of the year 2025.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in espect of time available, to redeem the secured assets The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the

property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda, for an amount of **Rs.1,48,587.85** /- interest and other charges thereon.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All the piece and parcel of immovable property bearing Flat No. LIG-3/J-407 admeasuring about build up area 41.090 sq mts & Carpet Area 35.577 sq. Mtrs on 4th floor together with individual proportionate share underneath land of Building No. LIG-3 of "Suman Swet constructed of the land bearing T.P.S. No 4 (RUNDH) of F.P. No 64 at Village: Rundh, Tal: City Surat, Dist: Surat.Boundaries are as under: East:- J-406, West:- Garden then after T.P. Road, North:- Passage & J-405, South:- Garden - C.O.P.

Date : 19.05.2025,Place :Surat

Authorized Officer, Bank of Baroda, Fulpada Branch



KHANDBAZAR BRANCH: Opp. Varachha Police Station

Varachha Road, Surat, Phone: (0261) 2544585 E-Mail: khasur@bankofbaroda.com

POSSESSION NOTICE [SECTION 13(4)] (For Immovable property) [Under Rule-8(1) of Security Interest (Enforcement) Rules 2002.]

bereas. The undersigned being the authorized officer of the Bank Of Baroda under the ecuritization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act. 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demar 11.02.2025 calling upon the borrower/mortgagor Mr. HARDIKKUMAR NANJIBHAI BHESARA (Borrower) & Mrs. MANISHABEN NANJIBHAI BHESARA (Co-Borrower) to repay ne amount mentioned in the notice being Rs. 9.44.162.8 /- (Rupees Nine Lakhs Forty Four Thousand One Hundred Sixty Two and Paise Eight only) plus interest and other charges within 60 days from the date of receipt of the said notice.

The borrower/mortgagor having failed to repay the amount, notice is hereby given to the porrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this the day of 17th day of May of the year 2025.

he borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, i espect of time available, to redeem the secured assets.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of **Bank of Baroda** for an amount of **Rs.9,44,162.8**/- plus interest and other Charges.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All those pieces and parcel of the immovable property i.e. Plot No. 523 admeasuring area
40.13 sq. mtrs. i.e. equivalent to 48.00 sq. yads (As per durast; Block/Plot No. 88/523
admeasuring 40.18 sq. mtrs.) of "Shiv Vatika; Vibhag-2" along with undivided proportional
share admeasuring 22.43 sq. mtrs. in the common roads and COP of the said society of the
land bearing Block No. 66 (After Re-survey, Block Nos. 87 and 88); Revenue Survey, Nos.
70/1 and 70/2 of pmois: village; Nansaid Tablus; Kamere District Surat Surrounded by Said. 70/1 and 70/2 of moje: village: Nansad; Taluka: Kamrej; District: Surat.**Surrounded by:-East**:

Soc internal road, West: Adj. Plot no. 500, North: Adj. Plot. 522, South: Adj. Plot no. 52 Date: 17.05.2025,Place: Surat. Authorized Officer, Bank of Baroda, Khandbazar Branch,

STATE BANK OF INDIA - RASECC-BHARUCH 4th Floor, Golden Sqaure, Bholav Road, Bharuch - 392001

#### M: 7600039512, 7600039499, Email: sbi.10060@sbi.co.in RULE - 8 (1) POSSESSION NOTICE (For immovable property)

Whereas, The undersigned being the Authorised Officer of State Bank Of India-RASMECC Branch. Bharuch under the Securitisation and Reconstruction o Financial Assets and Enforcement of Security Interest [Act], 2002 and in exercise of lowers conferred upon me under section 13(12) read with Rule 3 of the Security nterest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 14-MAY-2024 calling upon the borrower Miss Shailaja Bhagwanswarup Kashyap to repay the mount mentioned in the notice being Rs. 9,33,032.00 (Rupees Nine Lakh Thirty Three Thousand and Thirty Two Only) Under Loan Account No.: 35116162167 as on 14-May-2024 together with further interest and incidental expenses, costs, charges etc. thereon within 60 days from the date of receipt of the said notice

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower, legal heirs (known - unknown), legal representatives (known - unknown) guarantor and the public in general that the undersigned as per the CJM Order No.150/2025, Date: 11.3.2025 has taken Physical Possession of the property described herein below in exercise of powers conferred on me under Section 13(4 of the said [Act] read with Rule 8 of the said rules on this 18th day of Month May of

The borrower, legal heirs (known - unknown), legal representatives (known unknown), guarantor and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of State Bank Of India-RASMECC Branch, Bharuch for an amount of Rs. 9,33,032/-(Rupees Nine Lakh Thirty Three Thousand and Thirty Two Only) Under Loar Account No.: 35116162167 as on 14-May-2024 together with further interest and ncidental expenses, costs, charges etc. thereon till payment and / or realisation. The borrower's attention is invited to provision of Sub-Section (8) of Section 13 of th

Act, in respect of time available, to redeem the secured assets DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY All that piece and parcel of Immovable Property Bearing R. S. No. 80-1, 80-2, 80-3 B1, New R S No. 80-1 Paiki Plot No. A/28, Serial No. 546, Property No. 546/A/28

SAMRAJYA SOCIETY" Adm. 112.25 Sq. Mtrs, Village: Surwadi, Tall: Ankleshw Dist. Bharuch and Bounded: East: Adj Internal Road, West: Adj Plot No. A/13 North: Adj Plot No. A/29, South: Adj Plot No. A/27 Date: 18.05.2025 **Authorised Officer** Place : Village: Surwadi State Bank of India - RASMECC,



KHANDBAZAR BRANCH: Opp. Varachha Police Station, Varachha Road, Surat, Phone: (0261) 2544585 E-Mail: khasur@bankofbaroda.com

POSSESSION NOTICE [SECTION 13(4)] (For Immovable property)
[Under Rule-8(1) of Security Interest (Enforcement) Rules 2002.]

nereas, The undersigned being the authorized officer of the Bank Of Baroda under the ecuritization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interes ct, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with ale 3 of the Security Interest (Enforcement) Rules, 2002 Issued a demand notice dated 11.02.2025 calling upon the borrower/mortgagor Mr. ATULBHAI PARBTBHAI SANGANI (Borrower), Mrs. TINABEN ATULBHAI SANGANI (Co-Borrower) & MR. GOPALA GADHIYA (Guarantor) to repay the amount mentioned in the notice being Rs.9,64,158.77/- (Rupees

borrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act readwith rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this the day of **17th day of May of the year 2025**.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of **Bank of Baroda** for an amount of **Rs.9,64,158.77/-** plus interest and other Charges.

(after Re-Survey Block No.: 7819) admeasuring about 40.15 sq. meters along with the construction of ground floor admeasuring about 40.15 sq. meters thereon of "Kamdhenu Residency\*, situated on the land bearing R.S. No.: 172, 173, 174, Block no.213/Ay90 of Village.: Velanja, Tal.: Kamrej, Dist.: Surat, along with the undivided share admeasuring around 24:51 sq. meters in C.O.P. & Road of the said land. The said property Surrounded by (as per sale deed) : East: Plot No.: 87, West: Society Road, North : Plot No.: 89, South : Plot

Date: 17.05.2025, Place: Surat.

Authorized Officer, Bank of Baroda, Khandbazar Branch,

**अ** बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda

Honey Park Road Branch: 3, Shivalik Western, L.P.Savani Road, Adajan, Surat-395009, Gujarat Tel – 0261-2746767 Email - honeyp@bankofbaroda.com

Possession Notice (for Immovable property) [Under Rule-8(1) of Security Interest (Enforcement) Rules, 2002] /hereas The undersigned being the authorized officer of the Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interes Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 27.02.2025 calling upon the borrower/guarantor MR. DINESHCHANDRA MANILAL PANCHOLI (Legal heir & Father of Applicant Jenishkumar Dineshchandra Pancholi), MRS. PRITIBEN JENISHKUMAR PANCHOLI (Co-Borrower) to repay the amount mentioned n the notice being Rs.8,49,240.57/-(Rupees Eight lakh Forty nine thousand two hundred forty and Paise Fifty seven Only) Plus interest and other charges thereon within 60 days rom the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this the day of **21st day of** 

May of the year 2025. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the

property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda, for an amount of Rs. 8,49,240.57/- (Rupees Eight lakh Forty nine thousand two hundred forty and Paise Fifty seven Only) Plus interest and other charges.

#### DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All the pieces and parcel of immovable property bearing Flat no.B-403(4th floor) admeasuring about 1150 sq fts super bullt up area 905.50 sq fts constructed on "B" Tower of "Rajhans Wings" together with undivided proportionale land admeasuring about 34.07 sq mtrs opp. L P Savani school constructed on land bearing Rev survey no.64/1 Block no.103 TP scheme no.08 (Palanpore) Final Plot no.71 of moje: Palanpore Taluka: Choryasi; District: Surat Boundaries are: By East: Flat no.B-404, By West: Building no."A", By North: COP By South: Common Passage & Flat no. 8-402.

Date: 21.05.2025.Place:Surat Authorized Officer, Bank of Baroda, Honey Park Branch, Surat.

FORM No. RSC-4 [Pursuant to Rule 3(3)]

BEFORE NATIONAL COMPANY LAW TRIBUNAL BENCH AT AHMEDABAD

IN THE MATTER OF SECTION 66 OF COMPANIES ACT, 2013 AND THE NATIONAL COMPANY LAW TRIBUNAL (PROCEDURE FOR REDUCTION OF SHARE CAPITAL OF COMPANY) RULES, 2016 COMPANY APPLICATION NO. 27 OF 2025

#### GOLDCOIN HEALTH FOODS LIMITED .....APPLICANT **PUBLICATION OF NOTICE**

Notice may be taken that an application was presented before tribunal at Ahmedabad bench on 15th May, 2025 for confirming the reduction of share capital of the above company from Rs.3,00,09,000 divided into 30,00,900 equity share of Rs. 10/- each fully paid up to Rs.1,50,04,500 divided into 30,00,900 equity shares of Rs. 5/- each.

to be consolidated as 1 (One) share of Rs.10/- each and consequently the paid-up share capital of the company will be Rs.1,50,04,500/- divided into 15,00,450 equity shares of Rs.10/-each. The notice to individual creditors has been issued. The list of creditors prepared as on 31st March 2025 by the company is available at the registered office of the company situated at A/16, 1st Floor, Vardan Tower

Please note that, 2 (Two) Equity shares of Rs.5/-each later are proposed

Pragatinagar, Naranpura, Ahmedabad, Gujarat-380013 for inspection on all working days during 11 am to 4 pm between Monday to Friday. f any creditor of the company has any objection to the application or the details in list of creditors, the same may be sent (along with supporting documents) and details about his / her name and address and name and address of authorized representative, if any, to the undersign at the registered office of the company within 3 months of date of notice.

If no objection is received within the time stated above, entries in list of creditors will, in all proceedings under the above petition to reduce the share capital of the company be treated as correct.

It may also be noted that a hearing has been fixed on Thursday, 21st August 2025 which tribunal shall hear the application. In case any creditor intends to attend the hearing, he should make a request along with his objection, if any. Dated this on 22nd day of May, 2025 at Ahmedabad.

Managing Director - DIN: 00633868



Aditya Birla Housing Finance Limited Registered Office- Indian Rayon Compound, Verava Gujarat- 362266 Branch Office- 2Nd Floor, Yogi Comple

150 Feet Ring Road Near Indira Circle, Vasundhara Omkar Society Manharpura 1, Madhapar, Rajkot Gujarat-360005 RAMESHRHAL HEMURHAL DETROJA Plot No-196/P Southern Side R.S.No 200/P2, Mahika Residential, Shree Naklank Park, Nr.Aji Dem Chowkdi, Off.Manda

Dunger Main Road, Raikot Gujarat-360003. 2. JAGRUTIBEN RAMESHBHAI DETROJA Plot No-196/P. Southern Side, R.S.No-200/P2, Mahika Residential, Shree Naklank Park, Nr.Aji Dem Chowkdi, Off.Manda Dunger Main Road, Raikot Gujarat-360003 3. RAMESHBHAI HEMUBHAI DETROJA KESHARI NANDAN. Shyam Nagar Mair

Road, Rajaram Street No-09 Corner, B/H Dudh Sagar Dairy Gate, Santkabir Road Raikot Guiarat-360001 4. JAGRUTIBEN RAMESHBHAI DETROJA KESHARI NANDAN, Shyam Nagar Mair

Road, Rajaram Street No-09 Corner, B/H Dudh Sagar Dairy Gate, Santkabir Road Raikot Guiarat-360001. 5. RAMESHBHAI HEMUBHAI DETROJA C/O KULDEVI BANGLES, Shakti Industria Zone, Street No-06, Nr. Municipal Corporation Office, Shakti Industrial Main Road

Santkabir Road, Raikot Guiarat-360003. 6. JAGRUTIBEN RAMESHBHAI DETROJA Block No-03, Pithdai, Bhavanagar Road Mahika Area, Shivam Park, Rajkot Gujarat-360002.

Subject: Notice for removal of articles Movable Items lying in the mortgaged/sealed premises situated at All That Piece and Parcels of Immovable Property Comprising of Residential Tenament on Land 51-84 Sq.Mt Southern Side of Plot No-196 Paiki Area Known As "Shree Naklank Park" Situated at Mahika Revenue Survey No-200/Paiki2/Paiki 2 Of Rajkot Taluka & District-Rajkot in the State of Gujarat Owned by

Jagrutiben Rameshbhai Detroja.

The undersigned being the Authorized Officer of Aditya Birla Housing Finance Limited ("hereinafter referred to as "ABHFL") having its Registered Office at Indian Rayon Compound, Veraval, Gujarat – 362266 and its branch office at 2nd Floor, Yogi Complex Nr.Indira Circle, 150 Ft Ring Road, Rajkot Gujarat-360005 do hereby, on behalf of and under the instructions of the secured creditor ABHFL, serves upon you the following notice. 1. That you addressee along with other co applicant contacted ABHFL for financia assistance, based upon the requests and representations of you borrower/s namely RAMESHBHAI HEMUBHAI DETROJA & JAGRUTIBEN RAMESHBHAI DETROJA hereinafter collectively referred to as the "Borrowers"), ABHFL sanctioned Loan Facility vide sanction letter dated 13-01-2023 and loan agreement 21-01-2023 for an amount of Rs.18,90,000/- (Rupees Eighty Lakhs Ninety Thousand Only).

2. Pursuant to execution of the said sanction letter dated 13-01-2023 and loan agree ment dated 21-01-2023 executed between Borrowers and ABHFL, the Borrowers had also deposited original title documents of subject property. We through this notice do hereby inform you that you have committed breach of the terms and conditions of the aforesaid loan agreement by inter alia defaulting in payment

of equated monthly instalments due and payable by you to ABHFL under the said loa . That upon getting no revert from you addressees with respect to loan repayment

ABHFL was left with no other option but to initiate actions under the SARFAESI Act and take help of Hon'ble CJM Court, Rajkot for taking physical possession of the property u/s 14 of SARFAESI Act. Accordingly, on the basis of the order dated 13th of March 2025 physical possession of the mortgaged property was taken on 27th of April 2025 in the presence of Hon'ble Court Commissioner. 5. Note that at the time of taking physical possession of the property you left some mov-

ables in the said premises. The Court Commissioner prepared the inventory in this regard and sealed the property in the presence of you. 6. That now the authorized officer of the ABHFL wants to sale of mortgaged property in

open auction and the above said material is still lying in the premises, You addresse are hereby called upon to remove all of the movables lying in the mortgaged property after intimation to authorized officer of the ABHFL within 15 days from the date of receipt of this notice failing which, ABHFL shall dispose of the aforesaid movables, deduct the expenses incurred by the ABHFL for disposal of the said movables and will refund the surplus amount (If any) in your bank account. Date:- 22.05.2025 Sd/- Authorized officer

For Aditya Birla Housing Finance Ltd. Place: Raikot

PUBLIC NOTICE

That our Client 1. Saliyabano Bilalahemad Shah, 2. Bilalahemad Anvarhasan Shah is willing to Purchase an Immovable Property (On NA Land) situated at Moje Bhadkodara, on land bearing Old R.S. no. 128 A + B Paikki New R.S. no. 190, Paikki Known as "MAHAVIR NAGAR" Paikki Plot No. 49, Plot area admeasuring 127.14 Sq. Mtrs., & Plot No. 50, Plot area admeasuring 127.14 Sq. Mtrs., & Plot No. 51, Plot area admeasuring 101.26 Sq. Mtrs., at Registration Sub – District Ankleshwar & District Bharuch, from its present owner Mohamad Musaddik Mohamad Rafik Pathan, and have therefore demanded for the Title Clearance Certificate of the said Properties. That amongst the aforesaid Properties Paikki Plot no. 50 was previously owned by Shyamadevi Phulkumar Kashyap, through a Sale Deed vides Registration no. 1190 dated 10.02.2012, Thereafter the said Property was owned by Krushnakuvar Dineshsinh Rathod through a Sale Deeds ides Registration no. 5485 dated 11.07.2013. That both the said Original Sale Deeds along with their Registration Receipts are found to be missing. Also, amongst the aforesaid 5485 dated 11.07.2013. That both the said Original Sale Deeds along with their Registration Receipts are found to be missing. Also, amongst the aforesaid Properties Paikki Plot no. 51, was previously owned by Fulkumari Biharilal Kashyap through a Sale Deed Vides Registration No. 1240, dated 09.03.2006, wherein the said Original Sale Deed along with its Registration Receipt is found to be missing, thereafter the said Property was owned by 1. Mohammad Mustkim Mohammad Makkukhan 2. Mohammad Mustkim Mohammad Miyaz Ahmad through a Sale Deed Vides Registration No. 4314, dated 18.11.2005, thereafter the said Property was owned by Angraj Biharilal Kashyap through a Sale Deed Vides Registration No. 7945, dated 01.10.2010, (Vides New Registration no. 2854 dated 28.03.2014), thereafter the said Property is presently owned by Musaddik Mohamad Rafik Pathan through a Sale Deed Vides Registration No. 4829, dated 07.06.2014, wherein the Original Registration Receipts of all the three said Sale Deeds are found to be missing. Therefore if any individual, Bank or any Financial Institution has its charge or lien on the said above captioned Property, then within 7 days from the publication of the notice may send their objections along with the Supportive Evidence. If not send within given period then my client will initiate further proceedings.

#### TEREDESAI ASSOCIATES

SAPAN TEREDESAI (ADVOCATE) | PAYAL TEREDESAI (ADVOCATE) | NIRAJ THAKKAR(ADVOCATE) 407-409, 4th Floor, Blueship Complex, Nr. Stock Exchange, Sayajiguni, Sayajiguni, Vadodara-5 Mo.: 7211181322

#### **♠** ★ HERO HOUSING FINANCE LIMITED

Registered Office: 09, Community Centre, Basant Lok, Vasant Vihar, New Delhi-110057 Branch Office: Office 638-639, 6th Floor, Old Amarpali Cinema, Ralya Road, Rajkot, Gujarat 360004.

PUBLIC NOTICE (E- AUCTION FOR SALE OF IMMOVABLE PROPERTY) [UNDER RULE 8(6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002]

NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY MORTGAGED WITH HERO HOUSING FINANCE LIMITED (SECURED CREDITOR) UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTERES ACT, 2002. Notice is hereby given to the public in general and in particular to the borrower(s) and guarantor(s) or their legal heirs/ representatives that the below described immovable properties mortgaged/charged to the Secured Creditor, the possession of which has been taken by the Authorized Officer of Hero Housing Finance Limited (secured creditor), will be sold on 27-June-2025 (E-Auction Date) on "AS IS WHERE IS", "AS IS WHAT IS" and "WHATEVER THERE IS" basis for recovery of outstanding dues from below mentioned Borrowers, Co-Borrowers or Guarantors. The Reserve Price and the Earnest Money Deposit is mentioned below. The EMD should be made through Demand Draft/RTGS/NEFT for participating in the Public E-Auction along with the Bid Form which shall be submitted to the Authorised Officer of the Hero Housing Finance Ltd On or before 26-June-2025 till 5 PM at Branch Office: Office 638-639, 6th Floor, Old Amarpali Cinema, Raiya Road,

oan	Name of Borrower(s)/ Co-		Type of Possession	Reserve Price			
ccount	Borrower(s)/ Guarantor(s)	Demand Notice	(Under Constructive	Earnest			
0.	/Legal Heir(s)/ Legal Rep.	Amount as on date	/ Physical)	Money			
HFRAJHOU2	JIGNASHA	21/10/2024,	Physical	Rs.			
000029538 //	NILAY RATHOD	Rs. 2,009,636/-	Filyalcai	16,35,000/-			
HFRAJIPL22		as on		Rs.			
00029539		14/05/2025		1,63,500/-			
escription of property: All that peace and parcels of property being Residential Flat No. 401 on							
th Floor, having built-up area admeasuring 27.31 Sq. mtrs. Carpet Area 23.32 Sq. mtrs. building							

known as name "Suvarnabhumi Apartment". Construction area Adm. 314.03 Sq. mtrs. (at place known as name of overarabilium, Apariment , Construction area Adm. 314.05 Sq. miss. (at piace 305.84 Sq. mitrs) Situate at of Plot No 58 Paikee of sand No 352 of revenue Survey No. 398 of Rajkol City of Taluka: and District: Rajkot in the State of Gujarat. With Common Amenities Written in Title incurrent Property Bounded By: North: Other's Property South:Flat No 402 East: Margin Space han 40.00 Feet Road West:Main Door of Flat, Passage and Stair Terms and condition: The E-auction will take place through portal https://sarfaesi.auctiontiger.ne on 27-June-2025 (E-Auction Date) After 11 AM onwards with limited extension of 10 minutes each.

he Intending Purchasers / Bidders are required to deposit EMD amount either through RTGS IEFT or by way of Demand Draft/RTGS/NEFT favouring the "HERO HOUSING FINANCE LTD. The EMD amount will be return to the unsuccessful bidders after conclusion of the E-auction. Terms and Conditions of the E-Auction: 1.E-Auction is being held on "As is where is Basis" & "As is what is Basis" & "whatever there is Basis" & "Without recourse Basis" and will be conducted "online". 2.Bid increment amount shall be Rs. 15,000-(Rupees Fifteen Thousand Only). 3.The E-Auction will be conducted through My E-Procurement Technologies Ltd. (Helpline Nots). 07961200576/544/594/596/531/583/569, 6351896643 and E-mail on support@auctiontiger.net/ maulik.shrimali@auctiontiger.net) at their web portal https://sarfaesi.auctiontiger.net.4.There is no encumbrance on the property which is in the knowledge of Secured Creditors. However, the ntending bidders should make their own independent enquires regarding the encumbrances, title of property put on auction and claims/ rights/ dues/ affecting the property, prior to submitting their bids. In this regard, the E-Auction advertisement does not constitute and will not be deemed to constitute ant commitment or any representation of Hero Housing Finance Limited. 5.The Authorized Officer Secured Creditor shall not be responsible in any way for any third party claims/ rights/ dues. The sale shall be subject to rules/ conditions/ prescribed under the Securitization and Reconstruction of inancial Assets and Enforcement of Security Interest Act, 2002. The other terms and conditions of the E-Auction are published in the following website: <a href="www.herohousingfinance.com">www.herohousingfinance.com</a> 6.For property details and visit to property contact to Mr. Jignesh Savjibhai Solanki/7984178663/jignesh.solanki@herohfl.com/and Shekhar Singh/9711522275/shekhar.singh@herohfl.com. The prospective bidders can inspect the property on 20-June-2025 between 11.00 A.M to 2.00 P.N

## 30 DAYS SALE NOTICE TO THE BORROWER/GUARANTOR/MORTGAGOR

The above mentioned Borrower/Mortgagor/guarantors are hereby noticed to pay the sum as mentioned in Demand Notice under section 13(2) with as on date interest and expenses before the date of Auction failing which the property shall be auctioned and balance dues, if any, will be recovered with interest and cost from you.

detailed terms and conditions of the sale, please refer to the link provided in https://uat.herohomefinance.in/hero\_housing/other-notice on Hero Housing Finance Limited acured Creditor's) website i.e., www.herohousingfinance.com

Date: 23/05/2025 Place: Raikot/Guiarat

For Hero Housing Finance Ltd Mr. Hari Rajawat, Mob- 9828677772 Email ID: hari.rajawat@herohfl.com

# HERO HOUSING FINANCE LIMITED

Finance Branch Office: Shop No -309, Third Floor, Nishal Centre, Near Nishal Circle, Pal, Surat, Guiarat - 39500.

UNDER RULE 9(1) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002 OTICE FOR SALE OF IMMOVABLE PROPERTY MORTGAGED WITH HERO HOUSING FINANCI IMITED(SECURED CREDITOR) UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF INANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002.

Notice is hereby given to the public in general and in particular to the borrower(s) and guarantor(s) o their legal heirs' representatives that the below described immovable properties mortgagedicharges to the Secured Creditor, the possession of which has been taken by the Authorized Officer of Here to the Secured Creditor, the possession of which has been taken by the Authorized Officer of Here Housing Finance Limited (secured creditor), will be sold on 09-June-2025 (E-Auction Date) on "AS IS WHERE IS", "AS IS WHAT IS" and "WHATEVER THERE IS" basis for recovery of outstanding dues from below mentioned Borrowers, Co-Borrowers or Quarantors. The Reserve Price and the Earnest Money Depost is mentioned below. The EMD should be made through Demand Draft/RTGS/NEFT for participating in the Public E-Auction along with the Bid Form which shall be Submitted to the Authorised Officer of the Hero Housing Finance Ltd On or before 07-June-2025 till 5 PM at Branch Office: Hero Housing Finance Ltd, Shop no -309, Third Floor, Nishal Centre, Near Nishal Circle, Pal, Surat, Gujarat -395007.

Date of Demand Notice/ Amount as on ossessio) (Under Guarantor(s) Legal Heir/Legal Rep Physical) HHFSURHOU Joshi Rinkuben 23000040134, Vinodray 21/05/2024 Physical Rs. Rs. 21,50,000/- 2,15,000/ 23000040134, HHFSURIPL Rs. 3,362,763/-as on 14/05/2025 23000040135

Description of property:- All that piece and parcels of B-Type, Plot No. 3, admeasuring 674.92 Sq. Ft. i.e. 74.99 Sq. Yard i.e. 62.70 Sq. Mt. along with 35.36 Sq. Mts. ground Adm. 53.88 Sq. Mts., & first floor Adm. 53.88 Total Adm. 98.06 Sq. Mts. construction know as name "SKYLINE VILLA", Situate at Block No. 61 (6173), admeasuring He. Are. 1-35-57 Sq. Mt., of Moje Village Atodara, Taluka: Olpad, District Surat, Gujarat. Own by, Rinkuben Viondray Joshi Property Bounded By:North: Block No. 62 Open Land, South: 12. Mts. Hoad, East: Plot No. 2, West: Plot No. 4 description Of Property

18/04/2024 Rs. 7,83,156/-as on 14/05/2025 HHFSURHOU RANJITSINH M 22000021220 SOLANKI Description of property:- All The Piece And Parcel Of Flat No. A/1/302, Admeasuring About 55.92 Sq. Mt. Super Built Up And 36.64 Sq. Mt. Built Up Situated On The 3rd Floor in Wing-a-1 Of \*omkar Residency\* Constructed On Land Bearing Plot No. 45 To 54 Organized On Land Bearing Block No. 83, Admeasuring About 69.81 Sq. Mt. Of At Moje Village Sayan, Sub District Olpad, District Stratt Together With Undivided Proportionate Share in The Said Land Admeasuring About 8.05 Sq. Mt. Bounded By: North: Flat No A-301, East: Entery Passage, South: Open Land, West: Open Land

Terms and condition:

The E-auction will take place through portal https://sarlaesi.auctiontiger.net on 09-June-202 (E-Auction Date) After 2.00 PM with limited extension of 10 minutes each. The Intending Purchasers / Bidders are required to deposit EMD amount either through RTGS NEFT or by way of Demand Draft/RTGS:NEFT favouring the "HERO HOUSING FINANCE LTD." The EMD amount will be return to the unsuccessful bidders after conclusion of the E-auction.

(1) E-Auction is being held on "As is where is Basis" & "As is what is Basis" & "whatever there is Basis" a "Without recourse Basis' and will be conducted "online". (2) Bid increment amount shall be Rs.15,000- (Hopees Fifteen Thousand Only). (3) The E-Auction will be conducted through Mis E-Procurement Technologies Ltd. (Helpline No(s): 07961200576/544/594/596/531/583/569, 6351896643 and E-mail on support@auctiontiger.net/maulik.shrimali@auctiontiger.net) at their web portal https://sarfaesi.auctiontiger.net/maulik.shrimali@auctiontiger.net/maulik.shrimali@auctiontiger.net/maulik.shrimali@auctiontiger.net/maulik.shrimali@auctiontiger.net/mover.the intending bidders should make their own independent enquires regarding the encumbrances, title of property put on auction and claims/ rights/dues/affecting the property, prior to submitting their bids. In this regard, the E-Auction advertisement does not constitute and will not be deemed to constitute ant commitment or any representation of Hero Housing Finance Limited. (5)The Authorized Officer/Secured Creditor shall not be responsible in any way for any third party claims/ rights/ dues. The sale shall be subject to rules/ conditions/ prescribed under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. The other terms and conditions of the E-Auction are published in the following website: www.herohousingfinance.com (6) For property details and visit to property contact to (1) E-Auction is being held on "As is where is Basis" & "As is what is Basis" & "whatever there website: www.herohousingfinance.com (6) For property details and visit to property contact to Mr. Hari Rajawat / 9828677772 / hari.rajawat@herohfl.com / and Shekhar Singh 9711522275 shekhar.singh@herohfl.com. (7) The prospective bidders can inspect the property on 02-June-2025 between 11.00 A.M to 2.00 P.M with prior appointment.

15 DAYS SALE NOTICE TO THE BORROWER/GUARANTOR/MORTGAGOR The above mentioned Borrower/Mortgagor/Guarantors are hereby noticed to pay the sum as mentioned in Demand Notice under section 13(2) with as on date interest and expenses before the date of Auction failing which the property shall be auctioned and balance dues, if any, will be recovered with interest and cost from you.

For detailed terms and conditions of the sale, please refer to the link provided in

https://uat.herohomefinance.in/hero\_housing/other-notice
on Hero Housing Finance Limited (Secured Creditor's) website i.e www.herohousingfinance.com FOR HERO HOUSING FINANCE LIMITED

Mr. Hari Rajawat, Mob- 9828677772 Email: hari.rajawat@herohfl.com

DATE : 23-05-2025 PLACE: SURAT/GUJARAT

Nine Lakks Sixty Four Thousand One Hundred Fiffy Eight and paise Seventy Seven Only) plus interest and other charges within 60 days from the date of receipt of the said notice. The borrower/mortgagor having failed to repay the amount, notice is hereby given to the

he borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, i espect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that piece & parcel of the property bearing Plot No.: 90 (as per KJP Block No.: 213/A/90)

# દાનિશ વિશે એક મોટો ખુલાસો થયો

# દાનિશ ISI એજન્ટ નીકળ્યો દિલ્હીમાં બેસીને કરતો હતો જાસૂસી

હતો. એ જ દાનિશ વિશે એક મોટો ખુલાસો થયો છે. એહસાન-ઉર-રહેમાન ઉર્ફે દાનિશ ISI એજન્ટ હતો. એજન્સીને મળેલી માહિતી અનુસાર, દાનિશ ઇસ્લામાબાદમાં ISIમાં પોસ્ટેડ

આવ્યો હતો.

કંપની ગલ્ક કર્સ્ટ કમર્શિયલ બ્રોકર્સ આવે છે.'

રાતોરાત ગાયબ થઈ જતાં

અને

હવે ફોનલાઈન કપાઈ ગઈ છે.

અને બધું સાફ કરીને ઉતાવળમાં હતું.'

ગયા છે.

305

બિઝનેસ બેમાં

કેપિટલ ગોલ્ડન

૩૦૫માં આ

કંપનીની ઑફિસ

હતી જે થોડાં

અઠવાડિયાં પહેલાં

ઈસ્લામાબાદ, તા. ૨૨ જેના દ્વારા ISI એજન્ટો વિઝા સંપર્કમાં હતી. પેછપરછ

### દાનિશ ઇસ્લામાબાદમાં ISIમાં પોસ્ટેડ હતો : દાનિશનો પાસપોર્ટ ઇસ્લામાબાદથી જ જારી કરવામાં આવ્યો હતો

ઉઠમણાઃ ભારતીયોએ કરોડો રૂપિયા ગુમાવ્યા

દુબઈ સ્થિત એક બ્રોકરેજ દરરોજ લોકો તેમના વિશે પૂછવા એના ગ્રાહકોને એક અનરેગ્યુલેટેડ

રોકાણકારોના લાખો રૂપિયા ડૂબી ગુમાવનારા મોહમ્મદ અને ફ્યાઝ ભારપૂર્વક દબાણ કરતી હતી.

પોયલ કેરળના રહેવાસી છે. તેમણે

(આશરે ૬૪

મોહમ્મદ નામના

અન્ય રોકાણકારે

દુબઈ, તા.૨૨ ચાલ્યા ગયા હતા. હવે અમારી પાસે

ગલ્ફ ફર્સ્ટ કમર્શિયલ લાખ રૂપિયા)નું

ઑનલાઇન પ્લેટફોર્મ <sub>૫૦,૦૦૦ ડોલર</sub>

**સિગ્મા-વન કેપિટલ** (આશરે ૪૩

દ્વારા રોકાણ કરવા માટે <sup>લાખ રૂપિયા)</sup>

કંપનીના પ્લેટફોર્મ પર શરૂઆતમાં

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, ED

દુબઈના કમર્શિયલ ડિસ્ટ્રિક્ટ ગલ્ફ ફર્સ્ટમાં ૭૫,૦૦૦ ડોલર

ટાવરના સ્વીટ **બ્રોકર્સ એના ગ્રાહકોને** રોકાણ કર્યું હતું.

એક અનરેગ્યુલેટેડ

ધમધમતી હતી ભારપૂર્વક દબાણ કરતી <sub>૨,૩૦,૦૦૦</sub>

નિર્જન છે. ગયા મહિના સુધી ગલ્ફ ડોલર (આશરે ૧.૯૬ કરોડ

ફર્સ્ટમાં લગભગ ૪૦ કર્મચારીઓ રૂપિયા) ગુમાવનારી એક વ્યક્તિએ

કામ કરતા હતા. તેમનું કામ કહ્યું હતું 'રિલેશનશિપ મેનેજર

સંભવિત રોકાણકારોમાં કોરેક્સ અમારી સાથે અમારી કન્નડા

રોકાશોને પ્રોત્સાહન આપવાનું હતું. ભાપામાં વાત કરતો હતો. આ

કેપિટલ ગોલ્ડન ટાવરના એક અમને થોડો નફો થયો હતો અને

સુરક્ષા ગાર્ડે કહ્યું હતું કે 'આ કંપનીના અમે કેટલાક પૈસા ઉપાડી પણ લીધા

માણસોએ ચાવીઓ પાછી આપી હતા. જોકે આજે લાગે છે કે એ

હતી. તેઓ ઑફિસમાં આવ્યા હતા 🛮 ફક્ત અમારો વિશ્વાસ જીતવા માટે

ED તમામ હદ પાર કરી

રહી છે: સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી, તા. ૨૨ ઓવ્યું હતું કે, ED બધી મયદાઓ

તમિલનાડુ સરકારની અરજી પાર કરી રહી છે. સુપ્રીમ કોર્ટે

પર સુપ્રીમ કોર્ટે EDને નોટિસ પહેલાથી જ EDની કાર્યવાહી પર

ફટકારી છે . તમિલનાડુ સરકારે કડક વલણ દાખવ્યું છે. સુપ્રીમ કોર્ટે

તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન EDને નોટિસ જાહેર કરી છે અને

(TASMAC) મુખ્યાલયમાં આ કેસમાં આગળની કાર્યવાહી પર

અરજી દાખલ કરી હતી. આ કેસ માત્ર બધી મર્યાદાઓ ઓળંગી રહ્યું

મદ્રાસ હાઈકોર્ટદ્વારા ફગાવી દેવામાં નથી, પરંતુ કોર્પોરેશન સામે કેસ

આવ્યો હતો. જેને સુપ્રીમ કોર્ટમાં કેવી રીતે દાખલ કરી શકાય તે અંગે

પડકારવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે પણ વિચાર કરવો જોઈએ. ચીફ

આ મામલે આગળની કાર્યવાહી પર જસ્ટિસ બીઆર ગવઈએ

નથી, પરંતુ તે

સંપૂર્ણપશે

ઉલ્લંઘન કરી

સુપ્રીમ કોર્ટ

ભૂતકાળમાં

એન્ફ્રોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા રોક લગાવી દીધી છે.

કપિલ સિબ્બલે CJI બેન્ચને જણાવ્યું સો લિસિટર

હતું કે, રાજ્ય સરકારે ૨૦૧૪- જ ન ૨ લ

૨૧માં ૪૧ FIR દાખલ કરી હતી, એસવી રાજુને

EDએ ૨૦૨૫માં આવીને કહ્યું કે, ED

કોર્પોરેશનના મુખ્યાલય પર દરોડા માત્ર બધી

પાડ્યા હતા, બધા ફોન છીનવી મર્યાદાઓ લેવામાં આવ્યા હતા, બધું ક્લોન 🛮 ઓળંગી રહ્યું

સીજેઆઈએ કહ્યું કે, આવા દે શ ના કિસ્સામાં તમે તેમની સામે કેસ સંઘવાદનું પણ

સુપ્રીમ કોર્ટે આ મામલે નોટિસ ઘણી વખત

જાહેર કરી છે. આ ઉપરાંત, એવું ED ન ી

પણ કહેવામાં આવ્યું છે કે, રજાઓ ધરપકડ અને

પછી કેસની સુનાવણી કરવામાં કાર્યવાહી પર

આવશે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટના પ્રશ્નો ઉઠાવ્યા

નિર્ણય પછી, આગળની કાર્યવાહી છે.

બંધ થઈ શકે છે. આજે સુપ્રીમ

કોર્ટમાં ED ની આ ટિપ્પણી ખૂબ જ

નોંધપાત્ર હતી, જ્યાં કહેવામાં

કરવામાં આવ્યું હતું. આ પછી

દાખલ કરી શકો છો, પરંતુ

કોર્પોરેશનો સામે નહીં? CJIએ

એસજી એસવી રાજુને કહ્યું કે,

તમારી ઇડી બધી હદો પાર કરી રહી

છે.

કરવામાં આવેલી તપાસ સામે

રોક લગાવવાની વાત કરી છે.

પાકિસ્તાન માટે જાસૂસી મેળવવા આવતા લોકો અને દરમિયાન જ્યોતિ મલ્હોત્રાએ કરવાના આરોપમાં ધરપકડ સોશિયલમીડિયાઈન્ફ્લુએન્સર્સ જણાવ્યું કે તે ૨૦૨૩ માં કરાયેલ યુટ્યુબર જ્યોતિ સાથે મિત્રતા કરીને, તેમને પાકિસ્તાન જવા માટે વિઝા પાકિસ્તાન બ્લેકમેઇલ કરીને, તેમને હની મેળવવા માટે દિલ્હી સ્થિત દૂતાવાસમાં તૈનાત દાનિશ ટ્રેપમાં ફસાવીને અને પૈસાની પાકિસ્તાન હાઈ કમિશન ગઈ સાથેનો સંબંધ પ્રકાશમાં આવ્યો લાલચ આપીને ભારત વિરુદ્ધ હતી. જયાં તેની મુલાકાત અહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ સાથે થઈ. દાનિશનો મોબાઇલ નંબર મેળવ્યા પછી, તેણે તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું.

જયોતિએ જણાવ્યું હતું કે દાનિશના કહેવાથી તે બે વાર પાકિસ્તાન ગઈ હતી. દાનિશના હતો. દાનિશનો પાસપોર્ટ જાસૂસી કરવા દબાણ કરે છે. આ આગ્રહથી જ તે પાકિસ્તાનમાં ઇસ્લામાબાદથી જ જારી કરવામાં પહેલા પણ પાકિસ્તાન અલી હસનને મળી, જેણે ત્યાં પાકિસ્તાન હાઈ કમિશનમાં ISI તેના રહેવા અને મુસાફરીની દાનિશને ભારતના વિઝા એજન્ટોને તૈનાત કરી રહ્યું છે, વ્યવસ્થા કરી. પાકિસ્તાનમાં, ૨૧ જાન્યુઆરી, ૨૦૨૨ ના જેનો ભારત વિરોધકરી રહ્યું છે. અલી હસન જ હતા જેમણે રોજ જારી કરવામાં આવ્યા હતા. જાસૂસીના આરોપમાં પકડાયેલી જયોતિની પાકિસ્તાની સુરક્ષા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી જયોતિ મલ્હોત્રાએ પોતાની અને ગુપ્તચર અધિકારીઓ સાથે ISI દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કબૂલાતમાં કહ્યું છે કે તે મુલાકાતનું આયોજન કર્યું હતું. કમિશનમાં એજન્ટોને તેમની પાકિસ્તાન હાઈ કમિશનના ત્યાં જ તે શાકિર અને રાણા પોસ્ટ બદલીને તૈનાત કરે છે, અધિકારી દાનિશ સાથે સતત શાહબાઝને પણ મળી.



ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના પ્રવાસ દરમિયાન દેશનોક સ્થિત સુપ્રસિધ્ધ કરણીમાતાના મંદિરની મુલાકાત લઇને મંદિરમાં વડાપ્રધાન મોદી પૂજા-દર્શન કરી

# સરહદી ક્ષેત્રોમાં નાના-શોર્ટ રેન્જ ડ્રોન મળી આવતા સુરક્ષા એજ-સી ચોંકી નવી દિલ્હી: પાકિસ્તાન સામેના વહન ફરી શકે તેવા આ ડ્રોન અનેક શકાશે અને કોણે શા હેતુથી સરહદી

જેથી તેના સ્ત્રોત અંગે માહિતી મેળવી છે.

ઓપરેશન સિંદુરમાં સૈન્યના ડ્રોન એ સરહદો પર મળ્યા છે. હવે સુરક્ષા ક્ષેત્રમાં આ ડ્રોન મેળવ્યા હતા તે અંગે મહત્વની ભર્મિકા ભજવી હતી પણ સરહદો શાંત થયા બાદ પણ પાક સાથેની સીમા પરથી શોર્ટ-રેન્જ નજીક આસપાસ ઉડી શકતા અને બિનલશ્કરી ઉપયોગમાં લેવા ડ્રોન અનેક સરહદી ક્ષેત્રમાં મળી આવતા હવે સુરક્ષા એજન્સીઓએ આ અંગે તપાસ હાથ ધરી છે. યુદ્ધના વાતાવરણ વચ્ચે સરહદી ક્ષેત્રમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ હતો પણ તે વચ્ચે આ ટુંકા અંતર સુધી ઉડી કુંબઈમાં પણ આવું બને! બ્રોકરેજ કંપનીના રાતોરાત શકતા અને કોઈ લશ્કરી નહીં પણ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી અથવા હળવી

નામ બદલેલ છે

મેં મારું જુનું નામ ભાવનાબેન ઉમેશકુમાર નાયક માંથી બદલીને નવું નામ ભાવનાબેન ઉમેશકુમાર નાયક કરેલ છે. રહેઠાણ: બી-૪૦૪, કનકકલા એપાર્ટમેન્ટ-૧, આનંદનગર રોડ, વેજલપુર, માણેકબાગ, અમદાવાદ-૩૮૦૦૧૫.

Notice Notice hereby given that AMAN S/O JEEWAT RAI, who is

residing at B-72, ORCHID WHITE FIELD, NR. MAKARBA RAILWAY, MAKARBA, GUJARAT, INDIA -380051, is applying to the secretary to the government of India in Ministry of home affairs for naturalization and that any person who knows any reason why naturalization should not be granted should send a written signed statement

#### of the facts to the said secretary. Notice

Notice hereby given that SUMAN D/O JEEWAT RAI, who is residing at B-72, ORCHID WHITE FIELD, NR. MAKARBA RAILWAY, MAKARBA, GUJARAT, INDIA -380051, is applying to the secretary to the government of India in Ministry of home affairs for naturalization and that any person who knows any reason why naturalization should not be granted should send a written signed statement of the facts to the said secretary.

મારૂ જૂનું નામ પ્રજાપતિ મંગળ રણછોડજીથી નામ બદલીને નવું પ્રજાપતિ મંગળાજી રણછોડજી કરેલ છે. ડી/૧૦ આશાપુરી ફ્લેટ જીવરાજ પાર્ક અમદાવાદ

નામ બદલેલ છે

ગલ્ફ ફર્સ્ટ કમર્શિયલ બ્રોકર્સ

ઑનલાઇન પ્લેટફોર્મ સિગ્મા-વન

આ બ્રોકરેજ ફર્મમાં નાણાં કેપિટલ દ્વારા રોકાણ કરવા માટે

#### CHANGED NAME

I have changed my name Old Name Prajapati Mangal Ranchhodji to New Name Prajapati Manglaji Ranchhodji Add: D-10, Aashapuri Flat, Jivraj Park, Vejalpur Ahmedabad-380051

## Notice

Notice hereby given that JEEWAT RAI S/O SUKHDEV, who is residing at B-72, ORCHID WHITE FIELD, NR. MAKARBA RAILWAY, MAKARBA, GUJARAT, INDIA -380051, is government of India in Ministry of home affairs for naturalization and that any person who knows any reason why naturalization should not be granted should send a written signed statement of the facts to the said secretary.

### શેર સર્ટીફીકેટ ખોવાયેલ છે તેની જાહેર નોટીસ

અમારા અસીલ કોકીલાબેન જીતુભાઇ શાહ રહે.: ૨૫, વૃંદાવન મેવાવાલા ફલેટ, કિરણપાર્ક પાસે, નવાવાડજ, અમદાવાદનાઓની સૂચના અને ફરમાઇશથી આ જાહેર ચેતવણી આપી જાહેર જનતાને જણાવવાનું કે, ડીસ્ટ્રીક્ટ સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-૨ (વાડજ)ના તા. સાબરમતીના મોજે ગામ વાડજના ટી.પી. નં. ૧૫ના ફા. પ્લોટ નં. ૧૬ની જમીનમાં ધી નુતન ગુજરાત ગવર્મેન્ટ એમ્પલોઇઝ કો.ઓ.હા.સો.લિ. આવેલ છે જેના સબ<sup>ે</sup>પ્લોટ નેં. ૨૨ થી ૨*૬*ની જમીન ઉપર બાંધવામાં આવેલ વૃંદાવન મેવાવાલા ફલેટના નામથી ઓળખાતી યોજનામાં આવેલ ફલેટ નં. ૨૫ વાળી મિલકત અમારા અસીલને સદરહું સોસાયટી દ્વારા શેર સર્ટીફીકેટ નં. ૫૭ના શેર નં. ૨૮૧ થી ૨૮૫ ફાળવી આપેલ હતા. પરંતુ અમારા અસીલ પાસેથી સદરહું શેર સર્ટીફીકેટ ખોવાઇ ગયેલ છે અને તેની ખુબ શોધખોળ કરવા છતાં તે આજદિન સુધી મળી આવેલ નથી. જેથી અમારા અસીલે સોસાયટી પાસે ડુપ્લીકેટ શેર સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી તે સંદર્ભે કોઇપણ વ્યક્તિ, પેઢી, બેન્ક, ટ્રસ્ટ, સંસ્થા કે મંડળી વિગેરેને કોઇપણ પ્રકારનો ચાર્જ, બોજો, લીયન, હોય તો તેઓએ અમોને લેખિત પ્રમાણિત પુરાવા સાથે આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭માં નીચે જણાવેલ સરનામે જાણ કરવી, ત્યારબાદ કોઇનો કોઇપણ પ્રકારનો વાંધો તકરાર નથી તેમ સમજી અભિપ્રાય આપવામાં આવશે. જેની તમામે નોંધ લેવી. અમદાવાદ તા. ૨૨-૫-૨૦૨૫ દિપક વી. શાહ (એડવોકેટ), ૩૮, મેવાવાલા नगर, किरशपार्क रोड, नवा वाडक, अमहावाह-१३. मो.: ८८८८०८५०१७

## સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ એ ડિશનલ નીડો હોમ ફાઇનાન્સ લિ.

nido (અગાઉની એડેલવેઇસ હાઉર્સિંગ ફાઇનાન્સ લિમિટેડ) રજિસ્ટર્ડ ઓફિસ આવેલી છે : ટાવર ૩, ૫મે માળે, વિંગ 'બી', ક્રોહિનૂર સીટી મોલ, ક્રોહિનૂર સીટી, ક્રિરોલ રોડ, કુર્લા (૫.) મુંબઈ- ૪૦૦૦૭૯ રિજનલ ઓફિસઃઓફિસ નં.૩૦૨-૩૦૪, ૩જે માળે, થર્ડ આઇ વિઝન બિલ્ડીંગ, પાંજરાપોળ-આઇઓઇએમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ સરફૈસી કાયદો, ૨૦૦૨ના નિયમ હેઠળ ૮ (૧)કબજા નોટિસ

નીડો હોમ ફાઇનાન્સ લિમિટેડ(અગાઇ એડેલવેઇસ હાઇસિંગ ફાઇનાન્સ લિમિટેડ તરીકે જાણીતી)ના અધિકૃત અધિકારી તરીકે નીચે સહી કરનારે <sup>હ</sup> સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (સેકંડ ઓર્ડિનન્સ, ૨૦૦૨ (૨૦૦૨ન ઓર્ડર ૩) અને સેક્શન ૧૩(૧૨) હેઠળ આપેલ સત્તાને ઘરિક્રવોરિટી ઈન્ટરેસ્ટ એન્કોસંમેન્ટ) નિયમો ૨૦૦૨ના નિયમ ૩ સાયે વંચાયે લેતા હેઠળ મળેલ અધિકારોનો ઉપયોગ કરીને નીચે જજ્ઞાવેલ દેવાદાર/રોને ડિમાન્ડ નોટિસો મોકલી હતી, જેમાં સંબંધિત દેવાદારોને જે તે નોટિસોમાં જ્લાવેલ ૨કમ ચૂકવલીની ખરેખરી તારીખ સુધીના તમામ કોસ્ટ્સ, ચાર્જિસ અને ખચાંઓ સાથે એના મળવાના દિન ૯૦માં ચૂકવી જવા જભાવેલ. સદરહુ દેવાદાચોસત-દેવાદારો રક્ષ્ પરત ચૂકવવામાં નિષ્ફળ ગયા હોઈને અગે દેવાદાચોસત-દેવાદાચેને તથા જાહેર જનતાને નોટિસ આપવામાં આવે છે કે નીચે સહી કરનારાએ નીચે જણાવેલ મેલકતનો સદર ક્રાયદાના સેક્શન ૧૩(૪) ને સદર નિયમો પૈકી નિયમ ૮ સાથે વંચાણે લેતા હેઠળ મળેલ અધિકારથી નીચે જણાવેલ તારીખોએ પ્રતીકાત્મ કન્સ્ટ્રક્ટિવ કબજો લીધો છે. દેવાદારોને વિશેષ રૂપે અને અને જાહેર જનતાને સામાન્ય રીતે મિલકત સાથે વ્યવહાર ન કરવા ચેતવણી આપવામાં આવે છે અને મિલકત સાથેના કોઈ પણ

સોદા નીચે જક્ષાવેલ રકમ અને સંબંધિત તારીખોથી થતા એની પરના વ્યાજ, કોસ્ટ્સ અને ચાર્જેસ સાથેની રકમ માટે નીડો હોય ફાઇનાન્સ લિમિટેડ(અગાઉ એડેલવેઇસ હાઇસિંગ ફાઇનાન્સ લિમિટેડ તરીકે જાલીતી)ના ચાર્જને અધીન ગલાશે. દેવાદારો, સહ-દેવાદારો અને જામીનદારો, સિક્યોરિટીઝ, બાકી લેલી રકમ, સેક્શન ૧૩(૨) હેઠળ મોકલેલ ડિમાન્ડ નોટિસ અને એમાં દાવો કરેલ રકમ તથ

૧. સુરીન્દરસિંઘ જગજિતસિંઘ ભસીન (દેવાદાર) જયેશ મનુભાઈ રાવલ(સહ-દેવાદા

રહે. સરનામું : ફ્લેટ નં . ૪૩, ભોંયતળિયે, બ્લોક નં . એમ૮, પ્રગતિનગર ફ્લેટ્સ , જીએચબી પાસે , નારણપુરા પંપીંગ સ્ટેશન પાસે , નારણપુરા અમદાવાદ-૩૮૦૦૧૩ લોન ખાતા નંબર: L2580STHL000005334320 - લોન એગ્રીમેન્ટ તારીખ: ૦૫/૦૬/૨૦૨૪ લોનની ૨કમઃ રૂ .૧૧,૬૦,૦૦૦/-/-(અંકે રૂપિયા અગિયાર લાખ સાઠ હજાર પૂરા ફક્ત) - ડિમાન્ડ નોટિસ તારીખઃ ૧૩/૦૨/૨૦૨૫

લેણી નીકળતી રેકમ : રૂ.૧૧,૯૨,૨૪૨.૭૧/- (અંકે રૂપિયા અગિયાર લાખ બાળું હજાર બસો બેંતાલીસ અને પૈસા ઇકોતેર પૂરા) પ્રતીકાત્મક/ કન્સ્ટક્ટિવ કબજા તારીખ: ૨૦-૦૫-૨૦૨૫

#### સિક્યોર્ડ અસ્ક્યામતની વિગતોઃ

સ્થાવર મિલકત તે મોજે ગામ વાડજ, તાલુકો: સાબરમતી, જિલ્લો : અમદાવાદ અને રજિ. પેટા જિલ્લો અમદાવાદ-૨ (વાડજ) ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બંધાયેલ, સર્વે નં. ૩૩૦/૧ની જમીન પર બાંધેલ એમ. આઇ.જી. નામે જાણીતી સ્ક્રિમમાં ,રહેણાંક મિલકત કલેટ નં. ૮/૪૩ માપણી લગભગ ૧૧૫ ચો. વાર, ભોંયતળિયે, બિલ્ડિંગ નં.૮ના તમામ હક્કહિસ્સા. સીમાઓઃ પૂર્વેઃ ખુલ્લી જમીન અને ૯.૧૫ મી. ટી.પી. રોડ, પશ્ચિમેઃ ખુલ્લી જમીન અને બ્લોક નં.૧૭, ઉત્તરેઃ ફ્લોટ નં.૪૪, દક્ષિણેઃ ખુલ્લી જમીન અને બ્લોક નં. ૯

સહી/- અધિકૃત અધિકારી વતી નીડો હોમ ફાઇનાન્સ લિમિટેડ (અગાઉના એડેલવેઈસ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ) તારીખઃ ૨૩-૦૫-૨૦૨૫

## BHAVNAGAR POLYTECHNIC INSTITUTE

એજન્સીઓ આ ડોન જે સામાન્ય રીતે પણ માહિતી મેળવી શકાશે. આ ડ્રોન

ઓનલાઈન- ઈ-કોમર્સ કંપનીઓ મારફત બહું ખર્ચાળ નથી અને તે મર્યાદીત અંતર

મેળવી શકાય છે. તે તરફ તપાસ કરી છે અને સમય સુધી ઉક્ષ્યનોની ક્ષમતા ધરાવે

(Approved by AICTE & Affiliated with GTU) Manage by Satadhar Medical & Educational Trust

Add; B/h Dhammapali Vipasyana Centre, Todi Village, Ta. Shihore, Dist. Bhavnagar-364270 Email: bhavnagarinstitute2014@gmail.com, Mo. 9824656081

Sr. No.	Branch	HOD	Lecturer
1	MECHANICAL ENGG.	01	05
2	CIVIL ENGG.	01	05
3	ELECTRICAL ENGG.	01	05
4	COMPUTER ENGG.	01	10

QUALIFICATION & PAY SCALES AS PER AICTE & GTU NORMS

INTRESTED CANDIDATES SHOULD SEND THEIR RESUME BY EMAIL ON OR BEFORE

DATE OF INTERVIEW IS ON 03/06/25 , PLACE AND TIME WILL BE INFORM TO SHORT-LISTED CANDIDATES

#### કોર્મ નં. RSC-4 [नियम उ(उ) अनुसार]

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ બેન્ચ અમદાવાદ સમક્ષ કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૬૬ અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (કંપનીના શેર મૂડી ઘટાડવા માટેની પ્રક્રિયા) नियमो, २०१५ ना संहर्लमां

કંપની અરજી નં. 27 OF 2025

### ગોલ્ડકોઈન હેલ્થ ફૂડ્સ લિમિટેડ .....અરજદાર नोटिसनुं पक्लीङेशन

૧૫ મે, ૨૦૨૫ ના રોજ અમદાવાદ બેન્ચ ખાતે ટ્રિબ્યુનલ સમક્ષ ઉપરોક્ત કંપનીની ભરપાઈ થયેલ મૂડી જે ૩૦,૦૦,૯૦૦ શર પ્રત્યેક રૂા.૧૦/-૩,૦૦,૦૯,૦૦૦ છે. તેના થી ઘટાડીને રૂા.પ/- નો એક એવા ૩૦,૦૦,૯૦૦ શેર ટોટલ ૧,૫૦,૦૪,૫૦૦ કરવા સારૂ અરજી કરેલ છે.

નોંધ લો કે પછી રૂા.પ/- પ્રતિ શેરના ર શેર કરીને ભરપાઈ થયેલ શેર મડી ૧૫,૦૦,૪૫૦ શેર પ્રતિ શેર મુલ્ય રૂા.૧૦/- એમ કરીને ૧,૫૦,૦૪,૫૦૦ થઇ થશ.

વ્યક્તિગત લેણદારોને નોટિસ જારી કરવામાં આવી છે. કંપની દ્વારા ૩૧ માર્ચ ૨૦૨૫ ના રોજ તૈયાર કરાયેલ લેણદારોની યાદી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ એ/૧૬, પહેલો માળ, વરદાન ટાવર, પ્રગતિનગર, નારણપુરા અમદાવાદ, ગુજરાત - ૩૮૦૦૧૩ ખાતે સોમવાર થી શુક્રવાર દરમિયાન સવારે ૧૧ થી સાંજે ૪ વાગ્યા દરમિયાન નિરીક્ષણ માટે ઉપલબ્ધ છે.

જો કંપનીના કોઈપણ લેણદારને અરજી અથવા લેણદારોની યાદીમાંની વિગતો જો કરવાના કોઇ વર્ષ હોયા તે (સહાયક દસ્તાવેજો સાથે) અને તેનું તેણીનું નામ અને સરનામા અને અધિકૃત પ્રતિનિધિનું નામ અને સરનામું, જો કોઇ હોય તો, નોટિસની તારીખ થી ૩ મહિનાની અંદર કંપનીની રજિસ્ટર્ડ ઓફિસમાં નીચે સહી કરનારને મોકલી શકાય છે.

જો ઉપર જણાવેલ સમયમર્યાદામાં કોઈ વાંધો ન મળે, તો કંપનીની શેર મૂડી ઘટાડવા માટે ઉપરોક્ત અરજી હેઠળની બધી કાર્યવાહીમાં લેણદારોની યાદીમાંની એન્ટ્રીઓને યોગ્ય ગણવામાં આવશે.

એ પણ નોંધવું જોઈએ કે ગુરૂવાર, ૨૧ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ સુનાવણી નક્કી કરવામાં આવી છે. જો કોઈ લેણદાર સુનાવણીમાં હાજર રહેવા માંગતો હોય, તો તેણે પોતાનો વાંધો હોય તો તેની સાથે વિનંતી કરવી જોઈએ. તારીખ ૨૨ મે, ૨૦૨૫ ના રોજ અમદાવાદ ખાતે.

સહી/- દેવાંગ પી. શાહ મેનેજીંગ ડાયરેકટર - DIN:00633868

## SBIનો વિચિત્ર નિર્ણય : સગીરના બેન્કખાતાના

# ચેકથી IPO માટે અરજી કરશો તો નહીં સ્વીકારાય

સગીર વયના બાળકના ખાતામાંથી ચેક ફાડીને બોરોનાના ઇનિશ્યલ પબ્લિક ઓફરમાં અરજી કરનારની અરજીને સ્વીકારવાનો જ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની નારાયણનગર-ચંદ્રનગર શાખાના અધિકારીઓએ ઇનકાર કરી દીધો છે. તેમણે એવી દલીલ કરી હતી કે સગીર વયના ખાતેદારના ખાતામાંથી ચેક ફાડીને આઈપીઓમાં અરજી કરી શકાય જ નહિ. સગીરના બેન્ક ખાતાના ચેકથી આઈપીઓ માટે અરજી કરશો તો સ્વીકારવામાં નહીં આવે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની નારાયણ નગર બ્રાન્ચના સર્વિસ મેનેજર દીપક ઠાકોરે સગીરવયના બાળકના ખાતેમાંથી ઇશ્યૂ કરવામાં આવેલા ચેક સાથેની પબ્લિક ઇશ્યૂ માટેની અરજી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. અરજી કરનાર અંકીલ શાહને આ સંદર્ભમાં સ્ટોક એક્સચેન્જના સત્તાવાળાઓનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તમે આ અંગે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં ફરિયાદ કરી શકો છો.નવાઈ ૫માડે તેવી બાબત તો એ છે કે બીજી તમામ બેન્કો સગીર વયના બાળકના ખાતામાંથી ઇશ્યૂ કરવામાં આવેલા ચેક સાથેની આઈપીઓની અરજીનો સ્વીકાર કરે છે. એકમાત્ર નારાયણ નગરની સ્ટેટ બેન્કની બ્રાન્ય જ અરજી સ્વીકારવાનો ઇનકાર કરી રહી છે.આ સંદર્ભમાં દીપક ઠાકોરનો ગુજરાત સમાચારે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે હું થોડી વારમાં તમારી સાથે વાત કરું છે. તેમનો જવાબ ન આવતા તેમને ફરીથી ફોન લગાડતા તેમણે કહ્યું હતું કે તમારે જે કરવું હોય તે કરી લો. હું કોઈ જ જવાબ આપીશ નહિ.

#### એમ્કો એલીકોન (ઈન્ડિયા) લિમિટેડ CIN: L29199GJ1974PLC002574

રજીસ્ટર્ડ ઓફિસઃ આણંદ-સોજીત્રા રોડ, વલ્લભ વિદ્યાનગર-૩૮૮ ૧૨૦, ગુજરાત Ph: (02692) 230602 Fax: (02692) 236506. Email: investor@eimcoelecon.in Website : www.eimcoelecon.in

વિડિયો કોન્ફરન્સીંગ / અન્ય ઓડિયો વિઝયુઅલ માધ્યમો દ્વારા કંપનીની ૫૧મી વાર્ષિક સામાન્ય સભા અંગેની સૂચના

આથી નોટીસ આપવામાં આવે છે કે, એમ્કો એલીકોન (ઈન્ડિયા) લિમિટેડ કંપનીના સભ્યોની ૫૧મી વાર્ષિક સામાન્ય સભા ("એજીએમ") નોટીસમાં જણાવ્યા મુજબના વ્યવહારો કરવા માટે બુદાવાર ૨૫મી જૂન, ૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે વિડિયો કૉન્કરન્સિંગ ("VC") /

અન્ય ઓડિયો વિઝયુઅલ માધ્યમ ("OAVM") દ્વારા કરવામાં આવશે. ઉપર્યુક્ત મિટિંગ કંપની ધારા, ૨૦૧૩ અને તેના નિયમો હેઠળ તેમજ સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસ્કલોઝર રિક્વાયરમેન્ટસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ની સાથે કોર્પોરેટ અફર્સ મંત્રાલયે (MCA) બહાર પાડેલા પરિપત્રો અને સિક્યુરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ્ ઈન્ડિયા (SEBI) અંતર્ગત ઉપરોક્ત રીતે દર્શાવેલ વાર્ષિક સામાન્ય સભા VC / OAVM દ્વારા યોજવામાં આવશે. સામાન્ય સભ્યો આ વાર્ષિક સામાન્ય સભામાં શારીરિક હાજરી વિના VC OAVM दारा हाक्ट रही शहशे. इंपनी धारा, २०९३ नी इसम ९०३ ना डोरमनी गए।तरी માટે, જે સભ્યો VC/OAVM થી હાજરી આપશે, તેમને ગણવામાં આવશે.

સંબંધિત પરિપત્રોના પાલનમાં એજીએમની સૂચના અને નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૫ માટેના નાણાંકીય નિવેદનો નો સમાવેશ વાર્ષિક અહેવાલ ૨૦૨૪-૨૫, બોર્ડનો અહેવાલ, ઓડિટર્સ રિપોર્ટ અને તે સાથે જોડાયેલા અન્ય દસ્તાવેજો સાથે કંપનીના બધા સભ્યોને મોક્લવામાં આવશે, જેમના ઈ-મેલ આઈડી કંપની/ડિપોઝિટરી સહભાગી(ઓ) સાથે નોંધાયેલા છે. ઉપરોક્ત દસ્તાવેજો કંપનીની વેબસાઈટ www.eimcoelecon.in પર અને સ્ટોક એક્ષરોન્જની વેબસાઈટ પર, એટલે કે. બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્ષચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ પર www.bseindia.com અને www.nseindia.com, અનુક્રમે અને કંપનીના રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટની વેબસાઈટ પર, એમયુએફજી ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ("MIIPL") (અગાઉ લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ તરીકે ઓળખાતું હતું) https://instavote.linkintime.co.in/. પર પણ ઉપલબ્ધ રહેશે.

વાર્ષિક અહેવાલની સંપૂર્ણ વિગતો મેળવવા માટે ચોક્કસ માર્ગ સાથે વેબ લિંક ઘરાવતો પત્ર એવા સભ્યોને મોક્લવામાં આવશે જેમણે MIIPL અથવા DP સાથે તેમનું ઇ–મેઈલ આઈડી નોંધાવ્યું

ઈ-મેઈલ, પાનકાર્ડ, બેંક ખાતા ના સરનામાં નોંધાવવા/ સુધારવા બાબત (અ) જે સભ્યો શેર્સ ફિઝિક્લ મોડમાં ધરાવતા હોય અને જેમણે ઇ-મેઇલ, પાનકાર્ડ અને બેંક

ખાતાની વિગતો नोंधायेल न હોય / सूधारवाना હોય तेमशे https://web.in.mpms. mufg.com/EmailReg/ Email\_Register.html પર ક્લિક કરવું અને જરૂરી સ્વનિર્માણિત દસ્તાવેજો અપલોડ કરવા અથવા ઈ-મેલ આઈડી vadodara@in.mpms.mufg.com (२%२८) र अने द्रान्सइर अयन्ट) ने डे डंपनीना ई-मेईल आईडी investor@eimcoelecon.in પર ઈ-મેઈલ કરવા વિનંતી છે.

(બ) જે સભ્યો શેર્સ ડિમેટ મોડમાં ધરાવતા હોય તો, તે સભ્યોને તેમના સંબંધિત ડિપોઝીટરી પાર્ટીશીપન્ટસ સાથે ઈ-મેઈલ આઈડી, પાનકાર્ડ અને બેંક ખાતાની વિગતોની નોંધણી/સુધારો કરવા વિનંતી છે. જેમની સાથે તેઓ તેમના ડિમેટ એકાઉન્ટસ જાળવે છે.

વધુમાં જણાવવાનું કે રોબીના પરિપત્રો મુજબ ભૌતિક સ્વરૂપે શેર ધરાવતા શેર ધારકોને તેમના पान, કેવાયસી અને નોમીનેશનની વિગતો કંપનીને જણાવવા માટેની સૂચના/પત્ર મોકલી

આવકવેરા અદિનિયમ, ૧૯૬૧ ની પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કંપની ૧લી એપ્રિલ ૨૦૨૦ પછી તેના શેરધારકોને ચૂકવેલ ડિવિડન્ડ પર નિર્ધારિત દરે ટેશ એટ સોરો ("IDS" ધરાવતી રહેશે. ટીડીએસ દર શેરહોલ્ડરોની રહેણાંક સ્થિતિ અને તેમના દ્વારા સબમિટ કરેલા અને કંપની દ્વારા સ્વીકૃત દસ્તાવેજોના આધારે બદલાશે. તેથી સભ્યોને વિનંતી છે કે તેઓ ઉપર જણાવેલ પ્રક્રિયાનું પાલન કરીને ઉચ્ચ દરે વેરાની કપાત ઢાળવા માટે તેમના

પાનકાર્ડને અપડેટ કરવા અને ઉપલબ્ધ દસ્તાવેજો અપલોડ કરવા વિનંતી છે. સભ્યોએ MIPL ની વેબસાઈટની મુલાકાત લેવા અને ફોર્મ 15G/15H, દસ્તાવેજો કલમો ૧૯૬, ੧૯૭એ, FPI ਗੇਂधਈ ਪ੍ਰਸਾਈਪਕ કરવેરਾ ਵੇਦੀਤੇਕੀ ਪ੍ਰਸਾਈਪਕ, ਕੀਅਵ ਫੈਲ ਪ੍ਰਸਾਈਪਕ https://web.in.mpms.mufg.com/formsreg/submission-of-form-15g-15h.html પર અપલોડ કરવા વિનંતી છે, જેથી કંપની ચોગ્ચ ટીડીસ લાગુ કરીને ટેક્ષ રેટને નિર્ધારીત કરી શકે.

सभ्योने विनंती छे डे तेओ तेमने भोडसवामां आवेसी वार्षिड सामान्य समानी सूचनामां આપેલી બધી નોંધો કાળજીપૂર્વક વાંચે, ખાસ કરીને વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપવા માટેની સૂચનાઓ, વાર્ષિક સામાન્ય સભા દરમિયાન રિમોટ ઈ-વોટિંગ અથવા ઈન્સ્ટા મીટ હારા મતદાન કેવી રીતે કરવું.

સભ્યો કૃપા કરીને નોંધ લે કે ઉક્ત ઉલ્લેખિત પરિપત્રોને ધ્યાનમાં લેતાં કંપની, એજીએમની નોટીસ અને તેમના વાર્ષિક અઢેવાલની નકલો સભાસદોને ભૌતિક રવરૂપમાં મોકલશે નહીં. આ નોટીસ કંપનીના તમામ સભ્યોને માહિતી અને લાભ માટે આપવામાં આવી છે અને એમસીએ તથા સેબીના લાગુ પરિપત્રોનું પાલન કરે છે.

એમ્કો એલીકોન (ઈન્ડિયા) લિમિટેડ વતી, સ્થળ : વલ્લભ વિદ્યાનગર

**ਵਿਭੇਗਭੂਮਾਵ Edais** - ਭੰਪਰੀ ਲੇਡੇਟਵੀ

તારીખ : ૨૨મી મે, ૨૦૨૫

#### HDFC BANK We understand your world

એચડીએફસી બેંક લિમિટેડ શાખા: એચડીએફસી હાઉસ, મીઠાકળી સિક્સ લેન રોડ પાસે, નવરંગપુરા અમદાવાદ-૩૮૦૦૦૯. **ટેલ**: ૦૭૯-૨૬૫૬૩૩૭૯

પઝેશન નોટિસ

જયારે એચડીએફસી બેંક લિમિટેડના ઓથોરાઇઝ્ડ ઓફિસર (અગાઉની એચડીએફસી લિમિટેડે ૧૭ માર્ચ, ૨૦૨૩ ના રોજના આદેશ દ્વારા માનનીય એનસીએલટી - મુંબઇ દ્વારા મંજૂર કરાયેલ જોડાણની યોજનાના આધારે એચડીએફસી બેંક લિમિટેડ સાથે જોડાણ કર્યું હતું (એચડીએફસી), સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાસ્ત્રિયલ એસેટ્સ એન્ડ એન્ફાર્સનેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ ("કથિત એક્ટ") હેઠળ અને કલમ ૧૩(૧૨) હેઠળ પ્રદાન કરવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને સુરક્ષા હિત (અમલીકરણ) નિયમો ૨૦૦૨ ના નિયમ ૩ સાથે વાંચવામાં આવે છે, જેણે ઉપરોક્ત કાયદાની કલમ ૧૩ (૨) હેઠળ ડિમાન્ડ નોટિસ જારી કરી હતી, જેમાં નીચેના ઋણલેનાર (ઓ) / કાનૂની વારસદારો અને કાનૂની પ્રતિનિધિઓ (ઓ) ને તેમના નામ સામે ઉલ્લેખિત રકમની ચૂકવણી કરવા માટે કહેવામાં આવ્યું હતું. ઉપરોક્ત નોટિસોમાં ઉલ્લેખ કર્યા મુજબના દરો, ઉપરોક્ત નોટિસ/ની તારીખથી ૬૦ દિવસની અંદર, આકસ્મિક ખર્ચ, ખર્ચ, ચાર્જિસ વગેરે ચુકવણીની તારીખ અને / અથવા અનુભૂતિની તારીખ સુધી. 

ક્રમ ન.	ઋણલનાર (આ) / કાનૂના વારસદારો અને કાનૂની પ્રતિનિધિઓનું નામ	બાકી લેણાં	ડિમાન્ડ નોટિસ તારીખ	કબજાની તારીખ	સ્થાવર મિલકત(ઓ) / સિક્યોર્ડ એસેટ(ઓ) નું વર્ણન
એ	બી	સી	કી	ઈ	એફ
1	એમ.આર.મેવડા જયંતિ ડી (ઋણલેનાર) શ્રીમતી મેવાડા મનીષાબેન જયંતિ (સહ ઋણલેનાર)	3૧.૦૧.૨૦૨૫ ના રોજ રૂ. ૨૪,૩૪,૬૩૪/- અને રૂ. ૨,૦૪,૧૨૨/- બાકી		૨૧.૦૫.૨૦૨૫ સિમ્બોલિક પઝેશન	ફ્લેટ નં. એ/૨૦૪, બીજો માળ, દર્શન એપાર્ટમેન્ટ, સૂર્યમ સીએચએસેલ વિભાગ ૧, એફ પી # ૭૬, સર્વે # ૨૬૨, ટી પી એસ # ૪૫, ગોતા રેલ્વે ક્રોસિંગ નજીક, ચાંદલોડિયા અમદાવાદ-૩૮૦૦૬૧
2	શ્રી ભાટિયા સંજય ગજેન્દ્રભાઈ (ઋણલેનાર)	૩૧.૧૨.૨૦૨૪ ના રોજ રૂ. ૮,૯૬,૧૩૩/- બાકી	2017:1010:T-00000000000000000000000000000000	૨૧.૦૫.૨૦૨૫ સિમ્બોલિક પઝેશન	ફ્લેટ-એ/૨૦૧, બીજો માળ, ગ્રીન ઓરા - બ્લોક એ, પ્લોટ એફ પી ૧૫૪, યુનિટ ટી પી ૬૯, એસ નં. ૩૮૧/૧, સત્યમેવ હોસ્પિટલ પાછળ, સી. ટી. રોડ, નવો ચંદખેડા, અમદાવાદ: ૩૮૨૪૨૪

\*લાગુ પડતું હોય તે રીતે વધુ વ્યાજ સાથે, આકસ્મિક ખર્ચ, ખર્ચ, ચાર્જ વગેરે ચૂકવણીની તારીખ અને/અથવા પ્રાપ્તિની તારીખ સુધી જો કે, અહીં ઉલ્લેખિત ઋણલેનાર/કાનૂની વારસદારો અને કાનૂની પ્રતિનિધિઓ(ઓ) બાકી નીકળતી રકમની ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી, અહીં ઉલ્લેખિત ઋણલેનાર/કાનૂની વારસદારો અને કાનૂની પ્રતિનિધિઓ(ઓ) અને કાનૂની પ્રતિનિધિઓને અને સામાન્ય રીતે જનતાને નોટિસ આપવામાં આવે છે કે એચડીએફસીના અધિકૃત અધિકારી/ઓ એ કલમ ૧૩(૪) હેઠળ્ તેમને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને ઉંપર જણાવેલ સ્થાવર મિલકત (ઓ) / સુરક્ષિત સંપત્તિ (ઓ) નો ભૌતિક કબજો લીધો છે. ઉપરોક્ત અધિનિયમની ઉપર જણાવેલ તારીખો પરના ઉપરોક્ત નિયમોના નિયમ ૮ સાથે વાંચવામાં આવે છે.

અહીં ઉલ્લેખિત ઋણલેનાર(ઓ) / કાનુની વારસદારો અને કાનુની પ્રતિનિધિઓ(ઓ) ખાસ કરીને અને સામાન્ય રીતે જાહેર જનતાને અહીંથી ઉપરોક્ત સ્થાવર મિલકત (ઓ) / સિક્યોર્ડ એસેટ્સ (ઓ) સાથે વ્યવહાર ન કરવા ચેતવણી આપવામાં આવે છે અને ઉપરોક્ત સ્થાવર મિલકત (ઓ) / સિક્યોર્ડ એસેટ્સ (ઓ) સાથેનો કોઈ પણ વ્યવહાર એચડીએફસીના મોર્ગેજને આધિન રહેશે. ઋણલેનાર(ઓ) / કાનૂની વારસદારો/કાનૂની પ્રતિનિધિ(ઓ) ધ્યાન સુરક્ષિત સંપત્તિ/ઓ ને રિડીમ કરવા માટે ઉપલેબ્ધ સમયના સંદર્ભમાં કાયદાની કલમ ૧૩ ની પેટા-કલમ (૮) ની જોગવાઈઓ પર આમંત્રિત કરવામાં આવે છે.

પંચનામાની નકલો દોરવામાં આવી હોય અને માલ સુચિ કરવામાં આવેલ હોય તે અન્ડરસહી કરેલ વ્યક્તિ પાસે ઉપલબ્ધ હોય છે, અને ઉક્ત ઋણલેનાર(ઓ) / કાનૂની વારસદાર(ઓ) / કાનૂની પ્રતિનિધિ (ઓ) ને ઓફિસના સામાન્ય કલાકો દરમિયાન કોઈ પણ કામકાજના દિવસે નીચે સહી કરાયેલ પાસેથી સંબંધિત નકલ એકત્રિત કરવા વિનંતી કરવામાં આવે છે.

એચડીએફસી બેંક લિ. સહી/-અધિકૃત અધિકારી

રજિસ્ટર્ડ ઓફિસ: એચડીએફસી બેંક લિમિટેડ, એચડીએફસી બેંક હાઉસ, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ (વેસ્ટ). મુંબઈ-૪૦૦૦૧૩. CIN: L65920MH1994PLC080618 વેબસાઇટ: www.hdfcbank.com







તારીખ: ૨૨.૦૫.૨૦૨૫

સ્થળ : અમદાવાદ









